

પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.

| | |
|----------------|---|
| હોદ્દો | શ્રી હર્ષવર્ધન મોદી – નાયબ કમિશનર (એડમીન) (નિયંત્રણ અધિકારી) |
| સત્તાઓ ફરજો | વહીવટી: |
| | <p>૧ વિભાગ ઉપર નિયંત્રણ રાખી વિભાગીય વડા પાસેથી વિભાગીય માહિતી મેળવવી તથા જરૂરી સુચનાઓ આપવી વિભાગી કામગીરી કરવવી.</p> <p>૨ વિભાગીય વડાની રજા મંજુર કરવી તેમજ વિભાગીય વહીવટી મુશ્કેલીઓનું નિરાકરણ કરવું.</p> <p>૩ વિભાગીય કામગીરી સુવ્યવસ્થિત ચાલે છે કે કેમ તેનું નિયંત્રણ રાખવું તેમજ વિભાગીય અધિકારી તથા કર્મચારીની કામગીરી અંગ.ની બેદરકારી બાબતે મળેલ સત્તાની રૂઈએ જરૂરી કાર્યવાહી કરવી.</p> |
| નાણાંકીય સત્તા | વિભાગીય કામગીરી દરમ્યાન થયેલ ખર્ચ રૂ. ૨૫૦૦૦/- સુધીની મંજુરી ફરમાવી. |
| અન્ય | નિયંત્રણ અધિકારી તરીકે નિયમની જોગવાઈ અન્વયે મળેલ સત્તા મુજબ કાર્યવાહી કરવી. |
| ફરજો | <p>૧ વિભાગીય વડા તથા કર્મચારીઓ ઉપર જરૂરી દેખરેખ રાખવી અને નિયંત્રણ કરવું.</p> |

પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.

| | |
|----------------|--|
| હોદ્દો : | શ્રી એમ. વી. કુરેશી, ખાતાધિકારી |
| સત્તાઓ ફરજો | વહીવટી : |
| | <p>૧ નિયંત્રણ અધિકારીશ્રીની દેખરેખ અને માર્ગદર્શન હેઠળ વિભાગીય કામગીરી પોતાના તાબા હેઠળનાં કર્મચારીઓ પાસેથી કરાવવી અને જરૂરી માર્ગદર્શન પુરુ પાડવું</p> <p>૨ મળેલ સત્તાની રૂઈએ વિભાગીય કામગીરી ઉપર જરૂરી દેખરેખ રાખી કર્મચારીની નિષ્કાળજી અંગે કાર્યવાહી કરવી.</p> <p>૩ સામાન્ય ચૂંટણી, મધ્ય સત્ર ચૂંટણી/ પેટા ચૂંટણીને લગતી આનુષંધીક સૌંપવામાં આવે તે તમામ કામગીરી.</p> <p>૪ મતદારયાદીને લગતી તમામ કામગીરી તથા મતદાન મથકોને લગતી કામગીરી.</p> <p>૫ ઈ.વી.એમ.ને લગતી તમામ કામગીરી.</p> <p>૬ વોર્ડ સિમાંકનને લગતી કામગીરી.</p> |
| નાણાંકીય સત્તા | ૧ નીલ |
| અન્ય | ૧ નિયંત્રણ અધિકારી ધ્વારા જે કોઈ સત્તાઓ પુરી પાડવામાં આવે તેનું પાલન કરી કાર્યવાહી કરવી. |
| ફરજો | ૧ નિયંત્રણ અધિકારીની સુચના અને નિયમોનુસાર મળેલ સત્તાની રૂઈએ વિભાગીય કામગીરી કરવી. |
| | |

પ્રકરણ-૩ (નિયમ સંગ્રહ-૨)
અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજો

૩.૧ સંસ્થાના અધિકારીઓ અને કર્મચારીઓની સત્તા અને ફરજોની વિગતો આપો.

| | |
|-------------|---|
| હોદ્દો | શ્રી પથુભા એન. રાણા – જુનીયર કલાક્ષ |
| સત્તાઓ ફરજો | વહીવટી: |
| | ૧ વિભાગીય વડા તથા નિયંત્રણઅધિકારી ધ્વારા મળેલ સુચનાઓ મુજબ કામગીરી કરવી. ૨ હોદ્દાની રૂએ નિયમોનુસારની કરવાની થતી કામગીરી કરવી. |
| અન્ય | નીલ |
| ફરજો | ૧ વિભાગ ધ્વારા સમયાંતરે બનાવવાની થતી મતદાર યાદીઓ માટે ફાળવેલ કર્મચારીઓ પાસેથી વિભાગીય વડા તથા નિયંત્રણ અધિકારીની સુચના અન્વયે કામગીરી કરવી અને કરાવવી. ૨ વિભાગમાં જરૂરી દસ્તાવેજો રેકર્ડનું વર્ગીકરણ કરી જાળવણી કરવી તેમજ પત્ર વ્યવહારની કામગીરી કરવી. ૩ સરકારશ્રીમાંથી તેમજ મનપા તેમજ અરજદારીઓની પત્રો/ અરજી ઈન્વર્ડ કરવી, અધિકારીશ્રીના વંચાણે મુકવી તેમજ અધિકારીશ્રીની સુચના મુજબ જવાબ પાઠવવા, તથા ચુંટણી વિભાગના અન્ય કર્મચારીઓ ઉપર દેખરેખ રાખવી. ૪ મનપાની સામાન્ય/ મધ્યસત્ર પેટા ચુંટણી અંગે કરવાની થતી આનુષાંગિક કામગીરી કરવી. ૫ આર.ટી.આઈ. ના પત્રોના જવાબ તૈયાર કરવા તથા આઈ.ટી.આઈ.ને લગતી ત્રિમાસીક માહિતી આપવાની કામગીરી ૬ ઈ.વી.એમ.ને લગતી કામગીરી ૭ મતદાન મથકોની કામગીરી |